



AAV-002-001214 Seat No. _____

B. Com. (Sem. II) (CBCS) Examination

April / May - 2016

Banking - II

(Ele. I)

Faculty Code : 002

Subject Code : 001214

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : બંને વિભાગના જવાબ મુખ્ય ઉત્તરવહીમાં જ લખો.

વિભાગ – ૧

1. M.C.Q.

૨૦

- (1) શાખસર્જનની વ્યાખ્યા કોણે આપી ?

(a) થોમસ	(b) જસ્ટીસ વિલેસ
(c) લોર્ડ ચોરલે	(d) આર. એસ. સેયર્સ
- (2) ઈ.સ. ૧૯૮૦માં કેટલી બેંકોનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું હતું ?

(a) ૧૨	(b) ૧૪
(c) ૮	(d) ૬
- (3) ચેકના લક્ષણો _____

(a) લેખિત દસ્તાવેજ	(b) બિન શરતી હુકમ
(c) લખનારની સહી	(d) બધા જ
- (4) ચેક પ્રથાનો ઉદભવ કયારે થયો.

(a) ૧૭ મી સદીમાં	(b) ૧૮ મી સદીમાં
(c) ૧૯ મી સદીમાં	(d) ૨૦ મી સદીમાં
- (5) ચેકમાં કઈ વિગતનો સમાવેશ થતો નથી ?

(a) ગ્રાહકની સહીનો	(b) ચોક્કસ રકમનો
(c) તારીખનો	(d) ગ્રાહકના ફોટાનો

- (6) જે વ્યક્તિ દસ્તાવેજ ઉપર શેરો કરે તેને..... કહેવાય.
 (a) એન્ડોર્સર (b) એન્ડોર્સી
 (c) એન્ડોર્સમેન્ટ (d) બધા જ
- (7) ATM પુરું નામ
 (a) Automated Teller Machines
 (b) Any Time Money
 (c) Automated Time Machines
 (d) Any Teller Machines
- (8) ૧૮૮૧ના નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ અંતર્ગત નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા આપવામાં આવેલી છે.
 (a) કલમ-૧૩ (b) કલમ-૧૪
 (c) કલમ-૧૫ (d) કલમ-૧૬
- (9) શેરોના પ્રકાર.....?
 (a) સાદો શેરો અથવા સામાન્ય શેરો (b) સંપૂર્ણ શેરો
 (c) મર્યાદિત અથવા પ્રતિબંધક શેરો (d) બધા જ
- (10) શાખ સર્જન એ વેપારી બેંકનું કયું કાર્ય છે ?
 (a) ગૌણ (b) સામાન્ય
 (c) પૂરક (d) મુખ્ય
- (11) કોમ્પ્યુટરમાં સૌથી મોટી મર્યાદા કઈ છે ?
 (a) ખોટખાવાની (b) બંધ પડી જવાની
 (c) વાયરસની (d) ચલાવવામાં મુશ્કેલી
- (12) ચેકની વ્યાખ્યા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કઈ કલમમાં આપેલી છે ?
 (a) કલમ-૧૦ (b) કલમ-૬
 (c) કલમ-૩ (d) કલમ-૭
- (13) ક્રોસિંગ ચેકનાં કયા ખૂણામાં કરવામાં આવે છે ?
 (a) ડાબા ખૂણાની ઉપરનાં ભાગે
 (b) જમણા ખૂણાની ઉપરનાં ભાગે
 (c) ડાબા ખૂણાની નીચેનાં ભાગે
 (d) જમણા ખૂણાની નીચેનાં ભાગે

- (14) ચેકની વ્યાખ્યા કોણે આપી છે ?
 (a) લોર્ડ ચોરલે (b) જસ્ટીસ વિલેસે
 (c) જેવન્સ (d) થોમસે
- (15) નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટનો કાયદો કઈ સાલમાં આવ્યો ?
 (a) ૧૮૫૦ (b) ૧૮૮૧
 (c) ૧૯૦૦ (d) ૧૯૨૦
- (16) ૧૪ મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં કરવામાં આવ્યું ?
 (a) જુલાઈ ૧૯૬૯ (b) જુલાઈ ૧૯૪૯
 (c) જુલાઈ ૧૯૫૦ (d) જુલાઈ ૧૯૮૦
- (17) શેરોની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
 (a) કલમ-૧૫ (b) કલમ-૨૦
 (c) કલમ-૧૦ (d) કલમ-૧૩
- (18) " ચોરી અને છેતરપિંડી સામે ક્રોસિંગ એ એક મોટો બચાવ છે. "
 આ વિધાન કોણ કહે છે ?
 (a) જસ્ટીસ વિલેસ (b) લોર્ડ ચોરલે
 (c) જેવન્સ (d) થોમસ
- (19) બેંકિંગ સરવૈયામાં મુખ્ય કેટલા ભાગો હોય છે ?
 (a) ૨ (b) ૩
 (c) ૪ (d) ૫
- (20) ક્રોસિંગની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
 (a) કલમ-૧૨૩, ૧૨૪
 (b) કલમ-૧૨૫, ૧૨૬
 (c) કલમ-૧૨૭, ૧૨૮
 (d) કલમ-૧૨૯, ૧૩૦

વિભાગ - ૨

2. ચેકની વ્યાખ્યા આપી ચેકના પ્રકારો સમજાવો. (૧૦)
 અથવા
 બહુવિધ શાખસર્જનનો અર્થ અને પદ્ધતિ સમજાવો.

3. શેરોનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો. (૧૦)
અથવા
તરલતા અને નફાકારકતા વચ્ચેનો વિવાદ જણાવો.
4. બેંકિંગમાં ટેકનોલોજીની જરૂરીયાત – મહત્વ સમજાવો. (૧૦)
અથવા
સલામત ધિરાણના માર્ગદર્શક સિધ્ધાંતો વિસ્તૃત રીતે વર્ણવો.
5. ક્રોસિંગનો અર્થ અને તેના પ્રકારોની સમજૂતી આપો. (૧૦)
અથવા
પ્રોમિસરી નોટનો અર્થ અને તેનાં લક્ષણો વર્ણવો.
6. ટુંક નોંધ લખો : (કોઈપણ બે) (૧૦)
(1) વ્યાપારી બેન્કનું સરવૈયુ
(2) સ્વીફ્ટ (SWIFT)
(3) ડેબિટ કાર્ડ
(4) કોર બેંકિંગ
(5) એ.ટી.એમ. (ATM)

ENGLISH VERSION

Instructions: Write answers of both section in main answer sheet

SECTION – I

1. M.C.Q.

20

- (1) Who has given definition of credit creation ?
(a) Tomos (b) Justice Vellece
(c) Lord Chorle (d) R.S.Searse

- (2) How many banks were nationalized in 1980 in India ?
 (a) 12 (b) 14
 (c) 8 (d) 6
- (3) Characteristics of cheque _____
 (a) Written Document (b) Signature
 (c) Unconditional Order (d) Above all
- (4) In which century cheque system is started ?
 (a) 18th century (b) 19th century
 (c) 20th century (d) 21st century
- (5) A valid cheque does not contain following
 (a) Signature (b) Amount
 (c) Date (d) Photo
- (6) An Endorse the document is called _____
 (a) Endorser (b) Endorsee
 (c) Endorsement (d) Above all
- (7) The full form of 'ATM' is _____
 (a) Automated Teller Machines
 (b) Any Time Money
 (c) Automated Time Machines
 (d) Any Teller Machines
- (8) In which section is the definition of negotiable instrument act of 1981 has been given.
 (a) Sec-13 (b) Sec-14
 (c) Sec-15 (d) Sec-16
- (9) Types of Endorsement _____
 (a) Blank Endorsement (b) Full Endorsement
 (c) Restrictive Endorsement (d) Above all
- (10) What type of function is credit creation of Commercial Bank ?
 (a) Subsidiary (b) General
 (c) Supplementary (d) Main

- (11) Which is major limitation of computer ?
 (a) Damaged (b) Possibility of switch off
 (c) Virus (d) Difficult to operate
- (12) In which clause of Negotiable Instrument Act, the definition of cheque is given ?
 (a) Clause-10 (b) Clause-6
 (c) Clause-3 (d) Clause-7
- (13) In which corner of the cheque, we can mark crossing sign ?
 (a) Above left corner (b) Above right corner
 (c) Below left corner (d) Below right corner
- (14) Who has given definition of cheque ?
 (a) Lord Chorle (b) Justice Vellece
 (c) Jevance (d) Tomos
- (15) In which year, the negotiable instrument act was amended ?
 (a) 1850 (b) 1881
 (c) 1900 (d) 1920
- (16) In which year 14 Banks became nationalized ?
 (a) July 1969 (b) July 1949
 (c) July 1950 (d) July 1980
- (17) In which clause, the definition of endorsement are given ?
 (a) Clause-15 (b) Clause-20
 (c) Clause-10 (d) Clause-13
- (18) "Crossing is the best protection against thief and cheating."
 Who said this statement ?
 (a) Justice Vellece (b) Lord Chorle
 (c) Jevence (d) Thomas
- (19) How many parts are in balance sheet of bank ?
 (a) 2 (b) 3
 (c) 4 (d) 5
- (20) In which clause crossing has defined ?
 (a) Clause-123, 124 (b) Clause-125, 126
 (c) Clause-127, 128 (d) Clause-129, 130

SECTION – II

2. Explain definition and types of cheque. 10

OR

What is multiple credit creation ? Discuss the methods.

3. Give meaning of Endorsement. Describe its types. 10

OR

Give meaning of Endorsement. Describe its types.

4. Explain needs and importance of technology in banking. 10

OR

Explain in details about the guiding principles of safe lending.

5. What is crossing ? Explain its various types. 10

OR

Describe the meaning and characteristics of promissory note

6. Write short note : (Any Two) 10

- (1) Explain balance sheet of commercial bank.
- (2) SWIFT
- (3) Debit card
- (4) Core banking service
- (5) ATM